

# Visit of Vice President of India to Cambodia (11-13 November 2022)

## ભારતનાં ઉપ રાષ્ટ્રપતિની કમ્બોડિયાની મુલાકાત (11-13 નવેમ્બર 2022)

13 નવેમ્બર, 2022

ભારતનાં માનનિય ઉપ રાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર દ્વારા 11-13 નવેમ્બર 2022 નાં રોજ કમ્બોડિયાની સપળ અને ઉત્પાદક મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન, તેઓએ 12 નવેમ્બર 2022 નાં રોજ ASEAN-ભારત યાદગીરી શિખર સંમેલનમાં હાજરી આપી હતી. વર્ષ 2022 ASEAN-ભારત સંબંધોની 30મી વર્ષગાંઠ અને ASEAN-ભારત વ્યૂહાત્મક ભાગીદારીનાં 10 વર્ષ અંકિત કરે છે. આ શિખર સંમેલન ઐતિહાસિક હતું કારણ કે તે ASEAN-ભારત સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની ઉંચાઈ પર લઈ ગયું હતું. વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીનાં તત્વોની ઉદ્દોષણ કરતું સંયુક્ત સ્ટેટમેન્ટ જારી કરવામાં આવ્યું હતું.

2. માનનિય ઉપ રાષ્ટ્રપતિએ 13 નવેમ્બર 2022 નાં રોજ 17માં એશિયા શિખર સંમેલનમાં પણ હાજરી આપી હતી. આ શિખર સંમેલન દરમિયાન, તેઓએ પ્રાંત અગ્રિમ નેતાઓ સંચાલિત મંચ તરીકે EAS ની અગત્યતા પર પ્રકાશ પાડ્યો હતો અને તેને વધારે ગ્રાહ્ય, નક્કર અને ગતિશિલ બનાવવા માટે તેને વધારે મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. તેઓએ રેખાંકિત કર્યું હતું કે નેવિગેશન અને ઓવરફ્લાઈટની સ્વતંત્રતા સાથે મૂક્ત, ખુલ્લા, સમાવેશક અને નિયમો-આધારિત ઈન્ડો-પેસિફિકનો પ્રચાર કરવા માટે EAS એક મહત્વપૂર્ણ મંચ છે. ઈન્ડો-પેસિફિકમાં ASEAN કેન્દ્રિયતા તરફની ભારતની કટિબદ્ધતાનું પુનઃઉચ્ચારણ કરતા, તેઓએ IPOI સાથે AOIP નાં સંગમ પર નિર્માણ કરીને સહકાર વધારવા માટે આલ્વાન કર્યું હતું, અને મેરિટાઈમ સુરક્ષા, HARD, અને મેરિટાઈમ સંસાધનોનાં ટકાઉ વિકાસમાં EAS એજન્ડાને આગળ લઈ જતી ભારતની પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડ્યો હતો. માનનિય ઉપ રાષ્ટ્રપતિએ EAS અને ઈન્ડો-પેસિફિકની સીમાઓ પાર જતી અન્ન અને ઊર્જા સુરક્ષામાં વધારાને રેખાંકિત કર્યા હતા, અને 2023 માં આંતરરાષ્ટ્રિય બાજરા વર્ષમાં સંપૂર્ણ યોગદાન આપવા માટે EAS સભ્યોને આલ્વાન કર્યું હતું.

3. આ મુલાકાત દરમિયામ, માનનિય ઉપ રાષ્ટ્રપતિએ કમ્બોડિયાનાં રાજા, વડાપ્રધાન, સંસદનાં અધ્યક્ષ સાથે મીટિંગો પણ કરી હતી. આ તમામ મીટિંગોમાં, કમ્બોડિયાની આગેવાનીએ તેઓનાં મુશ્કેલીઓનાં સમયમાં સહિત તેઓનાં દેશને ભારત દ્વારા કરવામાં આવેલી સહાયતાની પ્રશંસા કરી હતી.

4. માનનિય ઉપ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન હન્સેનની હાજરીમાં, સંસ્કૃતિ, જૈવવૈવિધ્યતા અને આરોગ્યનાં

ક્ષેત્રોમાં સહકાર સંબંધિત ત્રણ એમઓયુ અને એક નાણાકીય વ્યવસ્થાનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું.

5. કમ્બોડિયામાં ત્રણ જીલ્લાઓ અને એક સામુદાયીક વસવાટનાં સ્થળમાંથી માર્ઇનો દૂર કરવા માટે 426,000 યુએસ ડોલરની સહાયતા અને આ દેશ માટે ITEC માં 200 થી વધારીને 250 સ્લોટ કરવાની અને ICCR શિષ્યવૃત્તિ 30 થી વધારીને 50 કરવાની જાહેરાત માનનિય ઉપ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી હતી.

6. અવકાશમાં માનનિય ઉપ રાષ્ટ્રપતિ વિયેતનામનાં વડાપ્રધાનને પણ મળ્યા હતા અને દ્વિવપક્ષીય અને બહુવપક્ષીય મુદ્દાઓની ચર્ચા કરી હતી.

7. માનનિય ઉપ રાષ્ટ્રપતિએ સિએમ રીપમાં તા પ્રોહમ મંદિર અને અંગકોર વાટ મંદિરની મુલાકાત લીધી હતી અને ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહેલ આ સાંસ્કૃતિક વારસા સ્થળો પર જીર્ણોદ્ધાર અને સંરક્ષણનાં કાર્યનું નિરીક્ષણ કર્યું હતું.

8. તેઓએ તા પ્રોહમ મંદિરમાં નૃત્યાંગનાઓનાં ખંડનું ઉદ્ધાટન કર્યું હતું. તા પ્રોહમનો જીર્ણોદ્ધાર અને સંરક્ષણ ભારતીય પુરાતત્વ વિભાગ અને APSARA (અંગકોર અને સિએમ રીપનાં પ્રાંતનાં રક્ષણ અને વ્યવસ્થાપન માટેનું પ્રાધિકરણ) ની ભાગીદારી પરિયોજના છે અને તે 2011 થી હાથ ધરવામાં આવ્યું છે. ભારત હાલમાં જીર્ણોદ્ધાર અને સંરક્ષણ કાર્યનો 3જો તબક્કો હાથ ધરી રહ્યો છે.

9. અંગકોર વાટ મંદિર પરિસર યુનેસ્કો વિશ્વ હેરિટેજ સ્થળ છે. કમ્બોડિયાનાં સમકાલિન ઇતિહાસનાં સૌથી મુશ્કેલ સમયગાળા પૈકી એક એવા 1986-1993 અવધિનાં સમયગાળામાં 4 મિલિયન યુએસ ડોલરનાં કુલ ખર્ચ પર અંગકોર વાટનાં જીર્ણોદ્ધાર અને સંરક્ષણનું કામ ભારત દ્વારા લેવામાં આવ્યું હતું.

10. ભારતનાં માનનિય ઉપ રાષ્ટ્રપતિની આ મુલાકાતે ASEAN સભ્ય રાષ્ટ્રો અને ખાસ કરીને કમ્બોડિયા સાથે આપણા નિકટનાં જોડાણોની પુનઃપુષ્ટિ કરી હતી.

**ફનોમ પેન્હ**

**13 નવેમ્બર, 2022**

**DISCLAIMER:** This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.